

# પ્રાર્થના પ્રવચન કાર્યક્રમ



ડૉ.એમ. આર.સોલંકી  
કન્વીનર

“પ્રાર્થના એટલે ઈશ્વરનો મોબાઈલ નંબર”  
“પ્રાર્થના એટલે આત્માનો ખોરાક”  
“પ્રાર્થના એટલે ઈશ્વરને સ્વાર્થ રહિત યાદ કરવા”

જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શક્તો હોય એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે તે માટે જરૂર છે માત્ર ધીરજ, શ્રદ્ધા અને પ્રાર્થના.

કોલેજમાં દિવસની શરૂઆત “સામૂહિક પ્રાર્થના” કાર્યક્રમથી થાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન દરેક તાલીમાર્થીને તક મળે તે રીતે પ્રાર્થના, ગીત, વક્તવ્ય, પ્રતિજ્ઞાપત્ર, વંદે માતરમ્ થી કાર્યક્રમ દરરોજ ચાલે છે. પ્રતિજ્ઞાપત્ર પણ તાલીમાર્થીઓ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં સામૂહિક રીતે પ્રાર્થનામાં નિયમિત રજૂ થાય છે. સમગ્ર પ્રક્રિયા બી.એડ્.ની તાલીમાર્થીના ભાગરૂપે થતી હોવાથી તાલીમાર્થીઓને કૌશલ્ય વિકસાવવાની ઉત્તમ તક અહીં પ્રાપ્ત થાય છે.

પ્રાર્થના પ્રવચન કાર્યક્રમના હેતુઓ:-

૧. તાલીમાર્થીનું તન અને મન ઈશ્વર તરફ વળે.
૨. તાલીમાર્થીઓમાં ગાન તથા અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થાય.
૩. તાલીમાર્થીઓ વિવિધ વિષયો પર પ્રેરણાદાયી વિચારો રજૂ કરતા થાય.
૪. તાલીમાર્થીઓ ઉત્કૃષ્ટ વક્તવ્ય માટેના પુસ્તકો વાંચવા માટે પ્રેરાય.
૫. તાલીમાર્થીઓની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય.
૬. તાલીમાર્થીઓમાંથી સ્ટેજ ફીઅર દૂર થાય અને સ્વતંત્ર અભિવ્યક્તિ માટેનો આત્મવિશ્વાસ વધે.
૭. તાલીમાર્થીઓમાં એકબીજા માટે સહકાર અને સમજણની ભાવનાનો વિકાસ થાય.

તાલીમાર્થીઓની સાથે સાથે અધ્યાપકો પણ પ્રાર્થના - પ્રવચન કાર્યક્રમ અંતર્ગત દર ગુરૂવારે વિવિધ ગીતો તથા તાલીમાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી બને તેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરે છે.

વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમ્યાન અધ્યાપકોએ વ્યક્ત કરેલા વિષયોની તથા પુસ્તક સમીક્ષાની યાદી

ક્રમ	નામ	વિષય પુસ્તક સમીક્ષા	વિષય
૧	ડૉ. ડી. આર. પરમાર	વિષય પુસ્તક સમીક્ષા	વાર્તા – ‘ટેડ’ અંગદનો પગ
૨	ડૉ. પી. કે. યાજ્ઞિક	વિષય પુસ્તક સમીક્ષા	ભગવદ્ ગીતાના દસ સૂત્રો Counselling – What, When, How : Meera Ravi
૩	ડૉ. ડી. એમ. પટેલ	વિષય પુસ્તક સમીક્ષા	ગણપતિ કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠાકર
૪	ડૉ.એમ.આર. સોલંકી	વિષય પુસ્તક સમીક્ષા	કૃષ્ણ પરના આક્ષેપોની સાચી સમજ ચુનીલાલ મળિયાની શ્રેષ્ઠ વાર્તા – ‘કમાઉ દિકરો’
૫	ડૉ. બી. આર. મિસ્ત્રી	વિષય પુસ્તક સમીક્ષા	Morning Motivation with Morari Babu અનુભવ : રાજ ભાસ્કર
૬	ડૉ. એમ. એચ. રાઠોડ	વિષય પુસ્તક સમીક્ષા	જીવન – એક આશ્ચર્ય... ‘માટીએ ઘડ્યાં માનવી’ – કુમાર પાળ દેસાઈ
૭	ડૉ. એસ.બી. ખેર	વિષય પુસ્તક સમીક્ષા	વિશ્વાસ, શિક્ષક, ‘વાચન’
૮	પ્રા. પી.કે. પ્રજાપતિ	વિષય પુસ્તક સમીક્ષા	પ્રેરણાદાયી વાર્તા ‘પ્રેરણા’ – રાજ ભાસ્કર
૯	ડૉ. વી.એલ. ભાવસાર	વિષય પુસ્તક સમીક્ષા	‘પુત્ર’ કૃષ્ણાયન